

કોવિડ-19 (Covid-19) કિસ્સાઓ ઉપર આધારિત પબ્લિક હેલ્થ ટીમ દ્વારા અઠવાડિક નિવેદન

2 સપ્ટેમ્બર 2021

27 ઓગસ્ટના રોજથી 7 દિવસો સુધીમાં (કે જેનો આધાર 1 સપ્ટેમ્બરના પ્રસિધ્ધ થયેલ ડેટા- માહિતી ઉપર રાખવામાં આવે છે) બ્રાઇટન અને હોવમાં (Brighton & Hove) અમારે કોવિડ-19 ના (COVID-19) નવા 908 ક-ફર્મ્ડ કે સમર્થિત કિસ્સાઓ થવા પામ્યા હતાં. આ છે:

- અગાઉના સાત દિવસોથી 29% નીચા કે ઓછા
- કે જે 100,000 રહેવાસીઓ દીઠના સમાનાર્થ કે તુલ્ય અઠવાડિક દર પ્રમાણે 311.2 કહેવાય
- સાઉથ ઇસ્ટ (South East) માટેના કરતાં વધારે ભાગે કે જે 100,000 દીઠ 284.4 હતાં
- ઇંગ્લેન્ડ (England) માટેના દર- પ્રમાણ નજીક કે જે 100,000 દીઠ 312.9 હતાં

બ્રાઇટન અને હોવ (Brighton & Hove) માટે આનો અર્થ શું થાય?

આ અઠવાડિયે શહેરમાં કોવિડ-19 (COVID-19) ના સમર્થિત કે ક-ફર્મ્ડ કેસીસ નીચે આવ્યા હતાં, અને હવે આપણો દર-પ્રમાણ સરેરાશ ઇંગ્લેન્ડ જેટલો સરખો રહ્યો છે. આ આવકારલાયક સમાચાર કહેવાય. આમ છતાં પણ, કેસીસની સંખ્યા ભાગે રહેતા, અને આપણામાંના ઘણા બધા રજાઓ અને ઉત્સવોમાંથી પાછા આવવાથી, અને ઘણા બધા શિક્ષણ અને નોકરી-રોજગારના સેટિંગ્સમાં પાછા વળવાથી, આથી હવે આવી રહેલ અઠવાડિયાઓમાં કદાચ વધારે કેસીસ તરફ દોરી જઈ શકે.

આપણી સ્થાનિક હોસ્પિટલોમાં કોવિડ-19 ની (COVID-19) અસરવાળા દરદીઓની સંખ્યા કે જેઓને સારવારની જરૂર હોય તે અગાઉના અઠવાડિયા જેટલી સરખી રહી છે, અને ગયા શિયાળામાં જોવામાં આવતા લેવલ કરતાં નીચે રહેલ છે.

આ બતાવી આપે છે કે હોસ્પિટલમાં દાખલ થવાના અને ગંભીર બીમારીઓના જોખમ- ભયને ઓછો કરવામાં વેક્સિનેશનનો પ્રોગ્રામ ખૂબજ અસરકારક રહ્યો છે. તે એવું મોખરે રાખે છે કે શક્ય હોય તેટલી જલદીથી જે કોઈ દરેકને વેક્સીન ઓફર કરવામાં આવે તે તેઓએ લઈ લેવું જોઈએ.

સ્કૂલનું નવું સત્ર કે ટર્મ – નવું માર્ગદર્શન

કોવિડ-19 ની (COVID-19) મર્યાદાઓ કે પ્રતિબંધો હળવા કરવાની સાથે, સરકારે શિક્ષણના સેટિંગ્સ માટે માર્ગદર્શનમાં સુધારાઓ કર્યા છે.

સ્થાનિક સ્કૂલો અને કોલેજીસ, કોવિડ (Covid) ટેસ્ટિંગ –તપાસ કરવાની અવશ્યકતાઓના સમાવેશ સાથે, તેઓની નવી ગોઠવણો વિષે કુટુંબોને સીધા જણાવી રહ્યા છે.

જ્યારે તેઓ પાનખર કે ઓટમ સત્ર- ટર્મની શરૂઆતમાં પાછા આવે ત્યારે, માધ્યમિક કે સેકન્ડરિ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને 2 ઓન સાઇટ (સ્થળ ઉપર) જલદીથી કોવિડ-19 (COVID-19) ટેસ્ટસ કે કસોટી કરવાની સલાહ આપવામાં આવે છે (કે જે 3 થી 5 દિવસોએ જુદી હોવી જોઈએ), અને જેને અનુસરીને ઘરે અઠવાડિયામાં બે વખત ટેસ્ટિંગ કરવું જોઈએ.

જો કે એવી કોઈ કાનૂની અવશ્યકતાઓ રહી નથી, પણ ચહેરા ઉપર માસ્કના કવરિંગ કે આવરણની અપેક્ષા રાખવામાં આવે છે અને 11 વર્ષની વયના યુવાનોને અને તેનાથી મોટી ઉંમરનાઓ પબ્લિક ટ્રેન્સપોર્ટમાં અને સમર્પિત થયેલ સ્કૂલ અને કોલેજના ટ્રેન્સપોર્ટ માટે આવી ભલામણ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય ફેરફારોમાં નીચેનાઓનો સમાવેશ થાય છે:

Gujarati

- બબલ્સ અને અલગ અલગ (સ્ટેગર્ડ) શરૂ અને પૂર્ણ કરવાના સમયોની હવે સલાહ આપવામાં આવતી નથી
- બાળકોને વળી પાછા વિરામના સમયો અને બપોરના ભોજન સાથે ભેગામળીને લઈ શકે અને પ્રેક્ટિકલ લેસનો અને સ્પોર્ટ્સ સાથે બીજા વર્ગોના અને યર ગ્રૂપ્સમાં ભાગ લઈ શકે
- સ્ટાફ અને મુલાકાતે આવનારાઓ માટે હવે ચહેરા ઉપરના કવરિંગની જરૂર નથી
- ગાઢ સંપર્કમાં રહેલ હોય તેવા નિશ્ચિત કરવામાં આવેલ વિદ્યાર્થીઓ અને શિષ્યોને (પથૂપિલ્સ) સ્વયં- એકાંતવાસ રાખવાની જરૂર નહિ રહે, તેમ છતાં પણ, જો પરિણામ પોઝિટિવ હોય તો તેઓએ PCR ટેસ્ટ કરાવી અને સ્વયં- એકાંતવાસ રાખવો જોઈએ

જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ અથવા કોલેજમાં પાછા આવે ત્યારે શું અપેક્ષા રાખી શકાય તે વિષે વધારે માહિતી માટે મુલાકાત લો gov.uk/backtoschool